

B.A. Semester - 2 (CBCS) Examination

March/April- 2019 (Old Course)

ECONOMICS : P3 PRINCIPLES OF ECONOMICS-2 (ELECTIVE-2)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો.
- પ્રશ્ન-૨ ઘટતા મળતરનો નિયમ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ “બદલાકમાણી કરતાં જે વધારાની આવક થાય છે તે ભાડું છે” – આધુનિક ભાડાનાં સિદ્ધાંતનાં સંદર્ભમાં આ વિધાન તપાસો
- પ્રશ્ન-૩ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો.
- પ્રશ્ન-૪ “નફો જોખમ વહોરવાનું નહિ, પરંતુ અનિશ્ચિતતા વહોરવાનું વળતર છે.” – ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ “નફો નવપ્રવર્તનનું પરિણામ છે.” – ચર્ચા કરો.
- પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
(૧) પેઢી વિકાસના લાભો.
(૨) ઉદ્યોગ વિકાસના લાભો.
(૩) આભાસી ભાડું.
(૪) ઘટતા મળતરનાં નિયમની ઉપયોગિતા.

ENGLISH VERSION

- Que-1 Clarify the interrelationships between Average cost and marginal cost with the help by diagram. (14)
OR
- Que-1 Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure.
- Que-2 Explain the law of Diminishing Returns. (14)
OR
- Que-2 “Rent is incurred if there is surplus over transfer earning” – Examine the statement with reference of modern theory of rent.
- Que-3 Explain the concept of opportunity cost with the help of illustration. (14)
OR
- Que-3 Explain the marginal productivity theory of distribution.
- Que-4 “Profit is not reward for bearing of risks but reward for bearing of uncertainty” – Discuss. (14)
OR
- Que-4 “Profit is a result of innovation” – Discuss.
- Que-5 Write short notes. (any two) (14)
(1) The advantage of expansions size of firm.
(2) The advantage of expansions size of Industry.
(3) Quasi-Rent.
(4) Usefulness of the law of diminishing return.
